

8.10 Detailed instructions for participation in the Buyback (tender of Equity Shares) as well as the relevant time table will be included in the Letter of Offer which will be sent in due course to the Shareholders as on Record Date.

Managing Director
(DIN: 00043344)
Place : Mumbai
Date : May 24, 2019

Wholetime Director
(DIN: 00042719)

Company Secretary

PRESSMAN



The India

Registered Office: "Dhun Build"
Corporate Office: Coromandel Tower
Website: www.indiacements.co.in Email ID: inv@indiacements.co.in

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2019

Sl. No.	Particulars	Quarter Ended
		31.03.2019
		Audited
1	Total Income from Operations	1581.38
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	62.17
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	62.17
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	43.85
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after Tax)]	38.55
6	Equity Share Capital	309.90
7	Other Equity (Reserves)	
8	Earnings Per Share (of Rs 10/-each) (for continuing and discontinued operations)	
	1.Basic (in Rs):	1.24
	2.Diluted (in Rs):	1.24


Note :

The above is an extract of the detailed format of Quarterly and Year ended Financial Results (Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year ended Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.nseindia.com and company's website (www.indiacements.co.in).

Place : Chennai
Date : 25.05.2019

MAHESHWARI LOGISTICS LIMITED

CIN: L60232GJ2006PLC049224
ADDRESS: MLL HOUSE, SHED NO. A2-3/2, OPP. UPL, 1ST PHASE, GIDC, VAPI-396195,
EMAIL: INFO@MLPL.BIZ, WEBSITE: WWW.MLPL.BIZ



Extract of Standalone and Consolidated Audited Financial Results for the Half-Year and year ended 31st March, 2019

(Amount in Lakhs)

Sr. No.	Particulars	Standalone				Consolidated	
		Half year ended		Year ended		Year ended	
		31-03-19 Audited	30-09-18 Unaudited	31-03-18 Audited	31-03-19 Audited	31-03-18 Audited	31-03-19 Audited
1	Total Income from Operations	54,485.18	49,436.10	45,452.77	103,921.28	87,289.03	103,934.45
2	Earnings before Interest Depreciation and Tax (EBITDA)	2,526.05	2,415.09	2,086.06	4,941.13	3,868.01	4,942.04
3	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1,220.57	1,087.33	1,006.14	2,308.30	1,789.25	2,309.20
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	1,220.57	1,087.33	1,006.14	2,308.30	1,789.25	2,309.20
5	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	751.14	728.51	652.63	1,479.65	1,164.73	1,473.98
6	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	751.14	728.51	652.63	1,479.65	1,164.73	1,473.98
7	Equity Share Capital (Face Value of Rs.10/- per Share)	1,479.86	1,479.86	1,479.86	1,479.86	1,479.86	1,479.86
8	Earnings per equity share (Rs. per share)						
	(a) Basic	5.08	4.92	4.41	10.00	7.87	10.00
	(b) Diluted						

Notes :

- The above Audited Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meeting held on 25th May, 2019.
- The above is an extract of the detailed format of Half yearly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Half yearly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.nseindia.com and the Company's website at www.mlpl.biz.
- The Board recommended a dividend of Rs. 1.20 (12%) per Equity Share of the face value of Rs. 10/- each for the financial year ended on 31st March, 2019 subject to the approval of shareholders in ensuing Annual General Meeting of the Company.
- Consolidation figures for the previous year ended 31.03.2018 is not applicable to the Company, and Consolidated figures ended 31.03.2019 only includes figures of M/s. Maheshwari Logistics (India) LLP which is incorporated on 18.12.2018.
- Figures have been regrouped wherever necessary or Previous year's figure have been regrouped/recast wherever necessary to confirm to the current half year's / year's classification.

For and on behalf of the Board of Directors of MAHESHWARI LOGISTICS LIMITED

Sd/-
Vinay Maheshwari
Chairman and Wholetime Director
DIN : 01680099

Place: Vapi
Date: 25/05/2019

ફાયર સેફ્ટી વગર ધમધમતી ૧૧૩૩ દુકાનો અને ૩૭ ક્લાસીસ સીલ

સુરત, તા. ૨૫
સુરત મનપાના ફાયર વિભાગે આજે ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતી ૧૧૩૩ દુકાનો અને ૩૭ ક્લાસીસ સીલ કરી દીધા હતા. ૪૯૯ જેટલા કોથિંગ ક્લાસીસનો સર્વે કર્યો હતો. દરમિયાન ૧૫૯ ક્લાસીસમાં સુવિધા જણાઈ ન આવતા નોટીસ ફટકારવામાં આવી હતી. આ સાથે ૧૨ હોસ્પિટલ અને બે રેસ્ટોરન્ટને પણ સીલ મારી દેવાયા હતા. દિવસ દરમિયાન આજે ૧૧૭૪ એકમોને સીલ મારવામાં આવ્યું હતું.

આપવામાં આવી હતી. આજે મનપાની વિવિધ ટીમ દ્વારા નાની-મોટા ક્લાસીસ, દુકાનો, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ સહીતની સંસ્થાઓની ચકાસણી કરવાની આવી હતી. દરમિયાન વરાછા વિસ્તારના પનવેલ પોઈન્ટમાં ૫૫ દુકાનો, ૭ ક્લાસીસ અને સ્કાયગ્રીન બીઝનેસ હબની ૧૫૦ દુકાનો અને પ્લેટોનીયલની ૩૨ દુકાન, ૪ ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધા ન જણાઈ આવતા દુકાનો સિલ કરી દેવામાં આવી હતી.



(તસવીર : કિમ્બલ નંગડીવાલા)

આજે ફાયર બ્રિગેડ દ્વારા ૧૧૩૩ દુકાન, રેસ્ટોરન્ટ મળી કુલ ૧૧૭૪ એકમોને ૩૭ ક્લાસીસ, ૧૨ હોસ્પિટલ અને ૨ સીલ મારી દેવાયાં હતાં.

ફાયર સેફ્ટી વગર જ ચાલતી અને સીલ મરાચેલી સંસ્થાઓની યાદી

કોમ્પ્લેક્ષનું નામ	દુકાનોની સંખ્યા	ક્લાસીસની સંખ્યા	હોસ્પિટલ	રેસ્ટોરન્ટ
પનવેલ પોઇન્ટ	૫૫	૦૭	---	---
સ્કાય ગ્રીન	૧૫૦	---	---	---
ન્યુ ઓપેરા હાઉસ	૭૮	---	---	---
રોયલ સ્કેવર	૦૨	---	૦૨	---
સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષ	૭૦	---	---	૦૨
સીવર પોઇન્ટ	૧૦૩	૧૭	૦૭	---
અરિહંત મોલ	૦૧	---	---	---
બોલી કોમ્પ્લેક્ષ	૬૩	---	---	---
વિરભદ્ર કોમ્પ્લેક્ષ	૦૨	૦૧	૦૩	---
વિનાયક આર્કેડ	૮૫	૦૪	---	---
એપલ સ્કેવર	૧૬૦	---	---	---
તુલસી આર્કેડ	૨૬૨	૦૪	---	---
પ્લેટોનીયલ પ્લાઝા	૩૨	૦૪	---	---
કુલ	૧૧૩૩	૩૭	૧૨	૦૨

સરથાણાની કરુણાંતિકામાં ૨૨ વિદ્યાર્થીઓ હોમાઈ જવાની ઘટના બાદ જાગેલી મનપાએ આક્રમક કાર્યવાહી હાથ ધરી: ૧૫૦ ટ્યુશન ક્લાસીસને નોટિસ ફટકારી; ઉપરાંત ૧૨ હોસ્પિટલ અને બે રેસ્ટોરન્ટને સીલ મારી દેવાયાં

હતાં. આ સાથે બતારના સીલ્વર ક્લાસીસ, ૪ હોસ્પિટલ, બે ક્લીનીક, વેસુના જોલી કોમ્પ્લેક્ષની ૬૩ દુકાન, દુકાન, ૩ હોસ્પિટલ, એક ક્લાસીસ પોઈન્ટ કોમ્પ્લેક્ષની ૧૭૩ દુકાન, ૧૭ વેસુના અરિહંત મોલની એક દુકાન, દુમસના વિરભદ્ર કોમ્પ્લેક્ષની ૨ દુકાન, ૩ હોસ્પિટલ, એક ક્લાસીસ સીલ કરી દેવામાં આવ્યું હતું.

મનપાને આખરે જ્ઞાન લાઘ્યું: ૧૬ કોમ્પ્લેક્સમાં ધમધમતી શાળાઓનું ગેરકાયદે બાંધકામ તોડાયું

સુરત, તા. ૨૬
તક્ષશિલા આર્કેડમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન નહી થાય તે માટે શહેરમાં આરંભે તાણી દેવાયેલા ટેમ્પરરી સ્ટ્રક્ચર દૂર કરવાની જાહેરાત મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. બે દિવસમાં સેક્ટરો

કરતા ૧૭ વિદ્યાર્થીઓના કેસો જવાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ૧ વિદ્યાર્થીઓનું ટૂકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ગોઝાટી ઘટના બાદ સમગ્ર શહેરમાં ગેરકાયદે તાણી દેવાયેલા બાંધકામ પર તવાઈ લાવવામાં

કરવામાં આવ્યો હતો. આ સાથે જ્ઞાનદિપ વિદ્યાલયના ચોથા માળે ૪ હજાર ચો.ફુટ અને જેવી મોડર્ન સ્કુલના ચોથા માળે ૨૪૦૦ ચો.ફુટ વિસ્તારમાં બનાવવામાં આવેલા પતરાના શેડનું દબાણ દૂર કરીને બંને શાળા પાસે બંને લાખ વહીવટી ચાર્જ

કરી બનાવવામાં આવેલા વાઈટ એન્ડ સીનેમાની તપાસ દરમિયાન વાઈટજનક બાંધકામ જણાઈ આવતા મનપા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

મનપાના ૭ પ્રોત્તમ ૧૬ કોમ્પ્લેક્સમાં ૪ હજાર ચો.ફુટ વિસ્તારમાં તાણી દેવાયેલું બાંધકામ દૂર કરાયું

પ્રોત્તમ	બિલ્ડીંગની સંખ્યા	બાંધકામ દુર કરાયું (ચો.ફુટ વિસ્તાર)
અઠવા	૧	૬૫૦૦
રોટેર	૩	૬૪૦૦
કતારગામ	૩	૯૯૦૦
વરાછા એ ૩	૨૮૯૦	
વરાછા બી ૧	૩૦૮૦	
લિંબાયત ૪	૧૩૩૫૦	
સેન્ટ્રલ ૪	૫૦૦	
કુલ	૧૬	૪૨૭૯૦

સરથાણાના તક્ષશિલા આર્કેડના ભયાવહ અગ્નિકાંડ બાદ જાગેલી મહાપાલિકાએ ૮૦ જેટલી ટીમ બનાવી સરવે હાથ ધર્યો: કતારગામની તક્ષશિલા, જ્ઞાનદીપ, મોડર્ન સ્કુલ, ગોડાદરાની શાળાઓ, ગીતાંજલિ, વર્ધમાન સહિત પૂણા અને કરંજ વિસ્તારની સ્કૂલોમાં ડિમોલીશન કરાયું

મિલકતોનો સરવે કરી લાખો ચોરસ વિસ્તારમાં તાણી દેવાયેલા બાંધકામનો ભુક્કો બોલાવી દેવામાં આવ્યો છે. આજે મનપાના વિવિધ ટીમો દ્વારા શહેરની ૧૬ જેટલા કોમ્પ્લેક્ષની તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ૪૨૭૯૦ ચો.ફુટ વિસ્તારમાં ગેરકાયદે તાણી દેવાયેલું બાંધકામ તોડવામાં આવ્યું હતું. જેમા જ્ઞાન જ્યોત, વર્ધમાન, એલ.પી.સવાણી, તક્ષશિલા, શ્રધ્ધા સહીતની વિદ્યાલયનો સમાવેશ થાય છે.

આવી છે. મ્યુ કમિશનરના આદેશથી ૮૦ જેટલી ટીમ બનાવીને મિલકતોનો સરવે કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કેટલીક મિલકતોની આગામી પર પતરનો રેડ ઉભો કરીને શાળા ચલાવવામાં આવતી હોવાનું જ્ઞાને આવતા મનપાને શાળાના સંચાલકને નોટીસ ફટકારી મનપાની મંજૂરી વગર તાણી દેવાયેલા બાંધકામોનો ભુક્કો બોલાવવાયો હતો.

કતારગામ જોન દ્વારા વિવિધ શાળાની તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તક્ષશિલા વિદ્યાલયના ચોથા માળે ૩૫૦૦ ચો.ફુટ વિસ્તારમાં બનાવવામાં આવેલા પતરાના શેડનું દબાણ દૂર કરી ૨ લાખ વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડના ત્રીજા અને ચોથા માળે બનાવવામાં આવેલા રોમમાં આગ ફાટી નિકળતા કોથિંગ ક્લાસમાં અભ્યાસ

આવી છે. મ્યુ કમિશનરના આદેશથી ૮૦ જેટલી ટીમ બનાવીને મિલકતોનો સરવે કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કેટલીક મિલકતોની આગામી પર પતરનો રેડ ઉભો કરીને શાળા ચલાવવામાં આવતી હોવાનું જ્ઞાને આવતા મનપાને શાળાના સંચાલકને નોટીસ ફટકારી મનપાની મંજૂરી વગર તાણી દેવાયેલા બાંધકામોનો ભુક્કો બોલાવવાયો હતો.


કતારગામ જોન દ્વારા વિવિધ શાળાની તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તક્ષશિલા વિદ્યાલયના ચોથા માળે ૩૫૦૦ ચો.ફુટ વિસ્તારમાં બનાવવામાં આવેલા પતરાના શેડનું દબાણ દૂર કરી ૨ લાખ વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

મારી મિલકતમાં કેમ ધૂસ્યા? પોલીસ બોલાવું છું, સીલ કરવા ગયેલા મનપા અધિકારીઓને કડવો અનુભવ

સુરત, તા. ૨૬
મનપાએ બે દિવસથી ફાયર સેફ્ટી ઝોનના સર્વે અને સીલિંગની કામગીરી હાથ ધરી રહી છે. આજે ઘોડદોડ રોડ પર એ. વિ. સન્ન નજીક આવેલ અરીહંત જવલસ પર ફાયર સેફ્ટીના સાધનોના અભાવે શોરૂમ સીલ કરવાની કામગીરી માટે ફાયર વિભાગના અધિકારીઓ પહોંચ્યા ત્યારે અપેક્ષા વિરુદ્ધ તેઓને કડવો અનુભવ થવા પામ્યો હતો.

આવું છે. આપ જે પણ હો, આ રીતે અચાનક મારી બિલ્ડિંગમાં કઈ રીતે આવી શકો, અને આવીને સીધા શોરૂમ સીલ કરવાની વાત કરવા લાગ્યા છો? પહેલા બહાર નીકળો, નહિ તો હું પોલીસ બોલવું છું. આપ જે પણ હો, આ રીતે અચાનક મારી બિલ્ડિંગમાં કઈ રીતે આવી શકો, અને આવીને સીધા શોરૂમ સીલ કરવાની વાત કરવા લાગ્યા છો? પહેલા બહાર નીકળો, નહિ તો હું પોલીસ બોલવું છું.

આ સંસ્થાએ દિવસમાં ફાયર સેફ્ટીની સગવડ ઉભી નહીં કરે તો તમામ મિલકતોને સીલ કરી કાયદેસરનો દંડની વસૂલાત કરવાની ગયા શુક્રવારે તા. ૨૪મી મેનો



જાણીને કામગીરીમાં સહકાર આપવાનું કહીને રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગે પણ સમાન કેરવવાનો ઝોડે આપ્યો હતો. આ મારી બિલ્ડિંગ છે. હું અહીં ૨૫ વર્ષથી શોરૂમ છું. આંવું સંભાળવા ટેવાયેલા ન હોવાથી ધીરબર તો ફાયરનો સ્ટાફ શું જવાબ આપવો એ જ સમજ શક્યો ન હતો. જો કે બાદમાં અધિકારીએ આવીને વાત કરી હતી, કે તમને અગાઉ પણ કરી દીધો હતો.

અધિકારીઓ અન્ય ફાયરના જવાનો સાથે શોરૂમમાં દાખલ થયા અને શોરૂમ સીલ કરવાનો છે. એમ કહેતા જ શોરૂમનો માલિક જે સ્થળ પર જ હાજર હતો એ અકગાઈ ગયો હતો. એને કહ્યું હતું કે આ મારી બિલ્ડિંગ છે. હું અહીં ૨૫ વર્ષથી શોરૂમ છું. આંવું સંભાળવા ટેવાયેલા ન હોવાથી ધીરબર તો ફાયરનો સ્ટાફ શું જવાબ આપવો એ જ સમજ શક્યો ન હતો. જો કે બાદમાં અધિકારીએ આવીને વાત કરી હતી, કે તમને અગાઉ પણ કરી દીધો હતો.

ઝાણીને કામગીરીમાં સહકાર આપવાનું કહીને રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગે પણ સમાન કેરવવાનો ઝોડે આપ્યો હતો. આ મારી બિલ્ડિંગ છે. હું અહીં ૨૫ વર્ષથી શોરૂમ છું. આંવું સંભાળવા ટેવાયેલા ન હોવાથી ધીરબર તો ફાયરનો સ્ટાફ શું જવાબ આપવો એ જ સમજ શક્યો ન હતો. જો કે બાદમાં અધિકારીએ આવીને વાત કરી હતી, કે તમને અગાઉ પણ કરી દીધો હતો.


વેસુના 'કોટેક સ્પા'માં બહારથી યુવતીને લાવવા મુદ્દે ટોળાનો આતંક: બે સંચાલકોને મારી નાંખવા પ્રયાસ

સુરત, તા. ૨૬
વેસુ ખાતે આવેલા એસએન અરીહંત બિલ્ડિંગમાં ચાલતા કોટેક સ્પાની અંદર યુવતીને લઈ ગયેલા યુવાન સાથે સ્પાના સંચાલકે માથાકૂટ કરતા યુવાને તેના ૧૦ થી ૧૨ માણસોને બોલાવી સ્પાના સંચાલક પર લોખંડના સળીયા વડે હવલેણ હુમલો કરી દીધો હતો તેમજ શરદ નામના બીજા એક વ્યક્તિને પણ માથાના ભાગે લોખંડના સળીયા મારી ગંભીર ઈજા પહોંચાડી નાશી ગયા હતા. ઉમરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

૧૧ વાગ્યાના સુમારે પ્રવિણ ભાંમેરે નામનો વ્યક્તિ એક યુવતીને લઈને સ્પામાં ગયો હતો ત્યારે સ્પાના સંચાલક વિશાલ બાજલાએ બહારથી કોઈપણ યુવતીને લાવવાની પરવાનગી નથી તેમ કહેતા પ્રવિણ ભાંમેરેએ તેની સાથે માથાકૂટ કરીને ઝડપે કર્યો હતો. ત્યારબાદ કોઈકને ફોન કર્યો હતો અને ૧૦ થી ૧૨ જણ લોખંડના સળીયા લઈને સ્પામાં ધસી આવ્યા હતા. અને ઝડપે કરી વિશાલ બાજલા અને તેના માણસ શરદને ઢોર માર માર્યો હતો. માથાના ભાગે લોખંડના સળીયા મારવાથી વિશાલ બાજલા અને શરદને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માર માર્યા બાદ પ્રવિણ ભાંમેરે અને તેના માણસે ત્યાંથી નાશી ગયા હતા.

સુરત ફાયર વિભાગને ૫૫ મીટરની ઊંચાઈએ પહોંચી શકતી અત્યાધુનિક સીડીવાળી ગાડી મળી

સુરત, તા. ૨૬
લેન્ડ માર્ક અને ઓર્થોડો ટાવરમાં લાગેલી ભિખણ આગની ઘટના બાદ ૭ ડ્રા કરવામાં આવ્યો હતો. નવેમ્બર-૨૦૧૭માં જર્મની માર્ગશિ કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં જર્મની ખાતે ઉક્ત



(તસવીર : કિમ્બલ નંગડીવાલા)

સુરત લાવવામાં આવી હતી. આ ફાયરની ગાડી પર લગાડવામાં આવેલી સીડી ૫૫ મિટરની હાઈટ સુધી જઈ શકે છે. આ સાથે આ લેડર ૩૬૦ ડીગ્રી જરૂરીયાત મુજબ રોટેશન કરી શકશે. જો કોઈ મોટી ઈમારતમાં આગ ફાટી નિકળે તો ફાયર કાપટરથી સેસ્યુ કરી શકશે.